

Ref: MIL/BSE/2021  
Date: 26.06.2021

To,  
The Corporate Relations department  
**Bombay Stock Exchange Limited**  
Department of Corporate Services  
P J Towers, Dalal Street, Fort,  
MUMBAI 400001

**Re: Maximus International Limited**  
**Script Code: 540401**

**Sub: Submission of publication of advertisement regarding 6<sup>th</sup> Annual General Meeting, e-voting and Book Closure information in the newspapers.**  
**Ref: Intimation under Regulation 30 & 47 and all other applicable regulations, if any, of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended from time to time.**

Dear Sir / Madam,


Pursuant to the Regulation 30 & 47(1)(d) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended from time to time, we are submitting herewith the newspapers clippings of Notice of the 6<sup>th</sup> Annual General Meeting, e-voting and Book Closure Information published in Business Standard, English language newspaper (having Nationwide Circulation) and Vadodara Samachar (Gujarati language newspaper) at Vadodara on Saturday, 26<sup>th</sup> June, 2021.

The above information is also available on the website of the Company <https://www.maximusinternational.in/>

Kindly confirm and take the above information on your records.

Thanking you,

**Yours faithfully,**  
**For Maximus International Limited**



Dharati Shah  
Company Secretary



Encl: As above

**MAXIMUS INTERNATIONAL LIMITED**

any dealings with the property be  
Townhall Branch for an amount of  
thousand one hundred and twenty

of sub-section (8) of section 13 of the  
secured assets.

**movable Property**

located at Plot no 16, Municipal no  
a, Bhalej Road, Anand, R.S. No. 2557,  
measuring 108.72 sq mtrs (78.00 Sq

rgin land

**Authorised officer  
Bank of Baroda**

**ODARA ZONE**

dodara - 390023.

032

**JEWELLERY/ORNAMENTS/COINS**

old jewellery/ornament/coins and  
k.

ate interest and all cost charges/  
will be put up for public auction in  
borrowers and no allegations or

er before the scheduled time/ date  
within 48 hours, failing which their  
reason in the case, the bidding  
e or place of the above scheduled

**MAXIMUS INTERNATIONAL LIMITED**

CIN - L51900GJ2015PLC085474

Regd. Office : 504A, OZONE,

Dr. Vikram Sarabhai Marg, Vadi-Wadi,

Vadodara - 390003, Gujarat. Tel No: (0265) 2345321

Email: info@maximusinternational.in - Website: www.maximusinternational.in

**NOTICE OF THE 6TH ANNUAL GENERAL MEETING, E-VOTING AND  
BOOK CLOSURE INFORMATION**

Notice is hereby given that:

- The 6th Annual General Meeting (AGM) of Maximus International Limited (the 'Company') will be held through Video Conferencing (VC) / Other Audio-Visual Means (OAVM) on Tuesday, July 20, 2021 at 03:00 P.M. (IST), in compliance with General Circular Nos. 14/2020, 17/2020, 20/2020 and 02/2021 and all other applicable laws and circulars issued by the Ministry of Corporate Affairs (MCA) and the Securities and Exchange Board of India (SEBI), to transact the ordinary and special business set out in the Notice calling the 6th AGM (Notice of the AGM). The Members participating in the AGM through VC/OAVM shall be reckoned for the purpose of the quorum under Section 103 of the Companies Act, 2013.
- In compliance with the above circulars, electronic copies of the Notice of the AGM and Annual Report 2020-21 have been sent to all the members whose email IDs are registered with the Company/Depository Participant(s). The Notice of the AGM and Annual Report 2020-21 are also available on the website of the Company at www.maximusinternational.in, Stock Exchange website i.e. BSE Limited at www.bseindia.com and also on the website of the CDSL at www.evotingindia.com. The dispatch of Notice of the AGM through emails has been completed on Friday, June 25, 2021.
- Members holding shares as on the cut-off date i.e. July 13, 2021 may cast their votes electronically on the business as set forth in the Notice of the AGM through the electronic voting system (remote e-voting/e-voting during AGM) of Central Depository Services (India) Limited (CDSL) (an agency appointed by the Company for providing the remote e-voting facility and e-voting facility during the AGM and conduct of AGM through VC/OAVM). All the Members are hereby informed that:
  - The business as set forth in the Notice of the AGM shall be transacted through remote e-voting or e-voting system at the AGM;
  - The cut-off date for determining the eligibility to vote by remote e-voting or by e-voting system at the AGM shall be Tuesday, July 13, 2021;
  - The remote e-voting shall commence on Saturday, July 17, 2021 at 9.00 a.m (IST);
  - The remote e-voting shall end on Monday, July 19, 2021 at 5.00 p.m (IST);
  - Remote e-voting module will be disabled after 5:00 p.m. on July 19, 2021;
  - Non-individual shareholders who acquires shares of the Company and becomes a member of the Company after Notice is sent and holds shares as on the cut-off date i.e. July 13, 2021, may obtain the login ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com. However, if he/she is already registered with CDSL for remote e-voting/e-voting then the existing user ID and password can be used for casting the vote. Individuals shareholders holding securities in demat mode and who acquires shares of the Company after Notice is sent and holds shares as on the cut-off date i.e. July 13, 2021 may follow steps mentioned in the Notice of AGM under point no. 10.
- Members may note that:
  - Once the votes on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently;
  - The facility for voting will also be made available during the AGM and those members present in the AGM through VC facility, who have not cast their vote on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through the e-voting system at the AGM.
  - The members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their votes again; and
  - Only persons whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall be entitled to avail the facility of remote e-voting or e-voting at the AGM.
- The manner of voting remotely for members holding shares in dematerialized mode and for members who have not registered their email addresses is provided in the Notice of the AGM.
- Members who have not registered their email addresses are requested to register their email addresses and mobile numbers with respective depository participant(s).
- If you have any queries or issues regarding attending AGM & e-voting from the CDSL e-voting system, you can write an email to helpdesk.evoting@cdslindia.com or contact at 022- 23058738 and 022-23058542/43.
- Book Closure:
 

The Register of Members and Share Transfer Books will remain closed from Wednesday, July 14, 2021 to Tuesday, July 20, 2021 (both days inclusive) for the purpose of Annual General Meeting for Financial Year 2020-21.

*Business standard* By Order of the Board

For Maximus International Limited

Date: 25.06.2021

Dharati Shah

Company Secretary



Bank, under the Securitization and Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002, (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest [Enforcement] Rules, 2002, issued demand notice dtd. 09.04.2021 calling upon the Borrower / Guarantor / Mortgagee Mr. Amit Kumar Chinubhai Solanki (Borrower & Mortgagee through his POA) & Mr. Chinubhai Khengarbai Solanki (Borrower & Mortgagee & POA holder of Mr. Amitkumar C. Solanki) A/c No. 519400NC00002903 & 5194009900000681 to repay the amount mentioned in the notice being Rs. 51,82,888.46 (Rupees Fifty One Lakhs Eighty Two Thousand Eight Hundred Eighty Eight and Paise Forty Six Only) less recovery if any, within 60 days from the date of notice/date of receipt of the said notice together with further interest, incidental expenses, costs, charges, etc. till date of payment and / or realization.

The Borrower/Guarantor/Mortgagee having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Guarantors/Mortgagee and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this 22nd day of June the year 2021.

The Guarantor/Mortgagee in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Punjab National Bank, for an amount of Rs. 51,82,888.46 (Rs. Fifty One Lakhs Eighty Two Thousand Eight Hundred Eighty Eight and Paise Forty Six Only) less recovery if any, and further interest & expenses thereon until full payment.

The Borrower's / Guarantor's/Mortgagee's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY**

All that part and parcel of the property of Mr. Amit kumar Chinubhai Solanki & Mr. Chinubhai Khengarbai Solanki consisting of Property situated at Flat No. F/003 on Ground Floor, of Block No. F, having Super Built-up area of admeasuring about 1197 Sq. Ft. (i.e. 111.45 Sq. Mtrs.) with / terrace right of 1050 Sq. ft. (i.e. 97.58 Sq. Mtrs.) in the Scheme name as "Savvy Solaris" in being constructed on NA land bearing Survey No. 197/1 and 198/1 paiki, Original Plot No. 127/part, proposed final plot no 101, admeasuring 13954 Sq. Mtrs. T.P. Scheme No. 21, of Mouje / Village-Motera, Taluka - Dascroi, District - Ahmedabad, Registration Sub-District Ahmedabad-06 (Naroda) Bounded By: North: Open Space, South: Internal Road, East: Flat No. F/002, West: Internal Road.

Date: 22.06.2021  
Place: Ahmedabad

Sd/- Authorised Officer,  
Punjab National Bank

**pnb** पंजाब नैशुनल बैंक **punjab national bank**  
SASTRA Circle, 6th Floor, Guarat Bhavan, Nr. M.J. Library,  
Ellisbridge, Ahmedabad - 380 006.

**POSSESSION NOTICE** Rule 8(1)

APPENDIX IV (For Immovable Property)

Whereas:  
The undersigned being the Authorized Officer of the Punjab National Bank, Under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of Powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules-2002, issued a demand notice dated 09.04.2021, calling upon the Borrower/Guarantors/Mortgagees- Late. Mr. Mukeshbhai Pragibhai Patel (Talaviya) To be represented by all Legal Heirs & Mrs. Vilasben Mukeshbhai Patel (Talaviya) (A/c No. 5194009300000678) to repay the amount mentioned in the notice being Rs. 1,20,87,984.98 (Rupees One Crore Twenty Lakh Eighty Seven Thousand Nine Hundred Eighty Four and paise Ninety Eight Only) less recovery if any, within 60 days from the date of notice /date of receipt of the said notice together with further interest, incidental expenses, costs, charges etc. till date of payment and / or realization.

The Borrower/Guarantors/Mortgagee having failed to repay the amount, notice is hereby given to the Borrower/Guarantors/Mortgagee and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Sub-Section (4) of Section 13 of Act read with Rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this 22nd day of June of the year 2021.

The Guarantor/Mortgagee in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Punjab National Bank for an amount of Rs. 1,20,87,984.98, less recovery if any, and further interest & expenses thereon until full payment.

The Guarantor's/Mortgagee's attention is invited to provisions of Sub-Section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured assets.

**Description of the Immovable Property**

All that part and parcel of the property of Mr. Mukeshbhai Pragibhai Patel (Talaviya) & Mrs. Vilasben Mukeshbhai Patel (Talaviya) consisting of Property situated at Flat No. A/701, Wing-A, Flat No. 701, Admeasuring 235.16 Sq.Mtrs. Super builtup area, 7th floor, with undivided proportionate share admeasuring 67.70 Sq.Mtrs. in the land of society, with membership right of the society with use common amenities, Viceroy Ville, Raviplaza Co Op. Hsg. Sc. Ltd. (1) Survey No. 284/2/2, Comprised in T.P. Scheme No. 1/B and allotted Final Plot No. 168 with N.A. Land Admeasuring 679 Sq.Mtrs (2) Survey No. 284/2/1, Comprised in T.P. Scheme No. 1/B and allotted Final Plot No. 167 with N.A. Land Admeasuring 1355.37 Sq.Mtrs (3) Survey No. 284/2/1, Comprised in T.P. Scheme No. 1/B and allotted Final Plot No. 167 with N.A. Land Admeasuring 1355.37 Sq.Mtrs paiki West Side N.A. land admeasuring 143.50 Sq.mtrs. (4) Survey No. 284/1, Comprised in T.P. Scheme No. 1/B and allotted Final Plot No. 168 with N.A. Land Admeasuring 1355.37 Sq.Mtrs paiki North-East Side N.A. land admeasuring 677.17 Sq.mtrs. (5) Survey No. 284/1, Comprised in T.P. Scheme No. 1/B and allotted Final Plot No. 168 with N.A. Land Admeasuring 1356 Sq.Mtrs paiki South-West Side N.A. land admeasuring 678.83Sq.mtrs. Moje(Sim)-Bodakdev, Taluka-Chatlodiya, District-Ahmedabad, Registration Sub-District-Ahmedabad-03(Memnagar) Boundaries:-  
East :- Marginal Open Space & Samarpan Bunglows  
West :- Marginal Open Space & Parking then T.P.Road  
North :- Marginal Open Space & Sarita Apartment  
South :- Passage, Lift and stair & then Flat No. B/701

Date : 22/06/2021  
Place : Ahmedabad

Authorised Officer  
Punjab National Bank

	Gross Weight (in Grams)
	29.48

	Gross Weight (in Grams)
esara, Surat	15.08

	Gross Weight (in Grams)
	18.05

	Gross Weight (in Grams)
ur	56.60
	126.30
epur	88.25
epur	86.00
udepur	106.35
udepur	64.00
udepur	62.90
udepur	172.30
	152.55
	145.50
	81.65
	178.85
	146.70
	68.20
	72.65
	39.00
	28.65
	28.40
eli,	73.30
eli,	87.85

MAXIMUS INTERNATIONAL LIMITED  
VADODARA  
504A, OZONE,  
DR. VIKRAM SARABHAI MARG,  
VADI-WADI,  
VADODARA - 390003, GUJARAT.

સત્ લક્ષ્યોના જાણાવ્યું હતું કે રથયાત્રા અંગે અસમંજસ ના હોવું બોધ્યું છે. કેસ ઘટ્યા છે અને તમામ છૂટછાટ આપવામાં આવી છે તો કોઈપણ સંબોગમાં રથયાત્રા કાઢવી બોધ્યું. સરકારે કમ્પ્લેટ રાખવો કે પછી લોકોની ભીડ એકઠી ના થવા દેવી, પરંતુ રથયાત્રા કાઢવા અંગે નિર્ણય લેવો બોધ્યું. રથયાત્રા નીકળશે તો સૌનું ભલું થશે. રથયાત્રા નહિ નીકળી તો સખત પગલાં લઈશ.

**મેક્સીમસ ઇન્ટરનેશનલ લિમિટેડ**

સીઆઈએન : L51900GJ2015PLC085474  
 રજી.કચેરી : ૫૦૪-એ, ઓઝોન,  
 ડૉ.વિક્રમ સારાભાઈ માર્ગ, વડી-વાડી,  
 વડોદરા-૩૯૦૦૦૩, ગુજરાત, ટેલી. નં.: (૦૨૬૫)૨૩૪૫૩૨૧  
 ઇમેઇલ: info@maximusinternational.in વેબસાઇટ: www.maximusinternational.in  
**૬ઠ્ઠી વાર્ષિક સાધારણ સભા, ઇ-વોટીંગની સૂચના અને ભુક કલોઝરની માહિતી**



**ડાયમાઇન્સ એન્ડ કેમીકલ્સ લિમિટેડ**  
 CIN NO: L24110GJ1976PLC002905  
 રજીસ્ટર્ડ ઓફિસ : પ્લોટ નં. ૧૩, પીસીસી એરિયા, પી.ઓ. પેટ્રોકેમિકલ્સ,  
 વડોદરા-૩૯૧૩૪૬. ફોન : ૦૨૬૫-૩૫૩૪૨૦૦ ફેક્સ : ૦૨૬૫-૨૨૩૦૨૧૮  
 ઇ-મેઇલ : secretarial@dacl.co.in વેબસાઇટ : www.dacl.co.in

**૪૫મી વાર્ષિક સામાન્ય સભાની સૂચના, ઇ-મતદાન માહિતી અને ભુક કલોઝર**

આથી સૂચના આપવામાં આવે છે કે ડાયમાઇન્સ એન્ડ કેમીકલ્સ લિમિટેડ ("કંપની") ની ૪૫મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) વિડીયો કોન્ફરન્સીંગ (VC) / અન્ય દ્રશ્ય - શ્રાવ્ય માધ્યમો (OAVM) દ્વારા મંગળવાર, જુલાઈ ૨૦, ૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાકે, જુન ૧૬, ૨૦૨૧ ના રોજ એજીએમની નોટિસમાં નક્કી કરાયેલા સામાન્ય અને ખાસ વ્યવસાયોને પાર કરવા રાખવામાં આવેલ છે. ઇ-મતદાન સંચાર અને વાર્ષિક અહેવાલ ઓડિટેડ નાણાકીય નિવેદનો સાથે મળીને બધા સભ્યોને, જેમણે કંપની / ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ સાથે તેમના ઇ-મેઇલ સરનામાં નોંધાવ્યા છે તેમને, ઇલેક્ટ્રોનિકલી રીતે જુન ૨૫, ૨૦૨૧ ના રોજ મોકલવામાં આવ્યા છે. ઉપરોક્ત નોટિસ, અન્ય દસ્તાવેજો કંપનીની વેબસાઇટ [www.dacl.co.in](http://www.dacl.co.in) પર ઉપલબ્ધ છે અને લીંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની વેબસાઇટ <https://instavote.linkintime.co.in> પર પણ ઉપલબ્ધ છે. કંપની એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ મુજબ, કંપની (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૦ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન અને ડિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ની નિયમન ૪૪ સાથે પાંચી, કંપની તેના સભ્યોને ઇલેક્ટ્રોનિક માધ્યમથી લીંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (LIPL) દ્વારા ઇ-મતદાન સેવાઓ દ્વારા એજીએમની સૂચનામાં સેટ કરવામાં આવેલા તમામ ડિઝિટલ સાધનો પર મતદાન કરવા માટે રીમોટ ઇ-મતદાન સુવિધા પ્રદાન કરે છે. જુલાઈ ૧૩, ૨૦૨૧ ના કટ-ઓફ તારીખના આધારે શેર ભૌતિક સ્વરૂપે અથવા ડિમીટીરિયલાઈઝ્ડ સ્વરૂપમાં ધરાવતા હોય તો, ૪૫મી એજીએમની નોટિસમાં રજૂ કરેલા તમામ ઠરાવો પર ઇલેક્ટ્રોનિક રીતે મત આપી શકે છે.

**તમામ સભ્યોને આ રીતે જાણ કરવામાં આવે છે કે :**

**રીમોટ ઇ-મતદાન**

- એ.જી.એમ. નોટિસમાં નક્કી કરાયેલા સામાન્ય અને ખાસ વ્યવસાયને LIPL દ્વારા પૂરી પાડવામાં આવેલ ઇ-મતદાન સેવા (ઇલેક્ટ્રોનિક માધ્યમો) મારફતે પણ વ્યવહાર કરવામાં આવશે.
- સભ્યોને એજીએમ ઇ-મતદાનની પ્રક્રિયા અને રીત વિશે જુન ૧૬, ૨૦૨૧ ના નોટિસના ભાગ રૂપે નોટિસનો સંદર્ભ લેવા વિનંતી કરવામાં આવે છે.
- એજીએમમાં રીમોટ ઇ-મતદાન દ્વારા મતદાનની ચોગ્યતા નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખ જુલાઈ ૧૩, ૨૦૨૧ છે.
- રીમોટ ઇ-મતદાન શુક્રવાર, જુલાઈ ૧૬, ૨૦૨૧ (સવારે ૯ :૦૦ વાગ્યાથી) શરૂ થશે અને સોમવાર, જુલાઈ ૧૯, ૨૦૨૧ (સાંજે ૫ :૦૦વાગ્યે) સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન, સભ્યો તેમના મત ઇલેક્ટ્રોનિક રીતે આપી શકે છે. ઇ-મતદાન મોડ્યુલ પછીથી LIPL દ્વારા નિષ્ક્રમ કરવામાં આવશે. સભ્યોના મતદાન અધિકારો જુલાઈ ૧૩, ૨૦૨૧ ("કટ-ઓફ તારીખ") મુજબના ઇન્ક્યુબેશન પ્રમાણમાં હશે. કોઈપણ વ્યક્તિ જે કટ-ઓફ તારીખ પર કંપનીનો સભ્ય છે તે એજીએમની નોટિસમાં રજૂ કરેલા તમામ ઠરાવો પર મત આપવા માટે પાત્ર છે.
- કોઈપણ વ્યક્તિ, જે એજીએમની નોટિસ મોકલ્યા બાદ કંપનીના શેર મેળવે છે અને કટ-ઓફ તારીખ જુલાઈ ૧૩, ૨૦૨૧ ના રોજ સભ્ય હશે તેઓ [enotices@linkintime.co.in](mailto:enotices@linkintime.co.in) પર વિનંતી મોકલીને લોગ-ઇન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. જો કોઈ વ્યક્તિ ઇ-મતદાન માટે LIPL સાથે પહેલાથી જ નોંધાયેલ હોય તો મત આપવા માટે હાલના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકે છે.
- પ્રશ્નોના કિસ્સામાં, સભ્યો FAQ અને <https://instavote.linkintime.co.in> પર "સહાય વિભાગ"નો સંદર્ભ લઈ શકે છે, શેરહોલ્ડરોને મતદાન માટેની માર્ગદર્શિકા વાપરી શકે છે અથવા [enotices@linkintime.co.in](mailto:enotices@linkintime.co.in) પર ઇમેઇલ અથવા ટેલીફોન નં. ૦૨૨-૪૯૧૨૬૦૦૦ ઉપર સંપર્ક કરી શકે છે. મેમ્બર્સ કંપનીના કંપની સેક્રેટરીને [secretarial@dacl.co.in](mailto:secretarial@dacl.co.in) અથવા કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ પર પણ લખી શકે છે.

**ભુક કલોઝર :**

- કંપની એક્ટ, ૨૦૧૩ ના સેક્શન ૯૧ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન અને ડિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમ ૪૨ અનુસાર, નોટિસ પણ આપવામાં આવે છે, કંપનીના રજિસ્ટર અને શેર ટ્રાન્સફર બુક્સ જુલાઈ ૧૪, ૨૦૨૧ થી જુલાઈ ૨૦, ૨૦૨૧ (બંને દિવસ સહિત), ૪૫મી એજીએમના હેતુ માટે અને અંતિમ ડિવિડન્ડની ચુકવણી માટે (જો એજીએમના સભ્યો દ્વારા મંજૂર કરવામાં આવે તો) બંધ રહેશે.
- સભ્યો તેમના તમામ પત્રવ્યવહારને રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ - લીંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ૧૦૨ અને ૧૦૩, શાંત્રીલા કોમ્પ્લેક્સ, ફર્સ્ટ ફ્લોર, એચડીએફસી બેન્ક સામે, રાધાક્રિષ્ણા યાર સ્ટ્રેટા પાસે, અકોટા, વડોદરા-૩૯૦૦૨૦ સાથે વાતચીત કરવાની વિનંતી કરવામાં આવે છે.

**બોર્ડના હુકમથી,**  
**ડાયમાઇન્સ એન્ડ કેમીકલ્સ લિમિટેડ વતી,**  
 સહી / -  
**હેમાશી પવાર**  
**કંપની સેક્રેટરી**  
 સ્થળ : વડોદરા  
 તારીખ : જુન ૨૫, ૨૦૨૧

- આથી સૂચના આપવામાં આવે છે કે :
- મેક્સીમસ ઇન્ટરનેશનલ લિમિટેડ (ધી કંપની)ની, ૬ઠ્ઠી વાર્ષિક સાધારણ સભા મંગળવાર, તા.૨૦મી જુલાઈ, ૨૦૨૧ના રોજ બપોરના ૩.૦૦ વાગે, જનરલ સર્કુલર નં.૧૪/૨૦૨૦, ૧૬/૨૦૨૦, ૧૭/૨૦૨૦, ૨૦/૨૦૨૦ અને ૦૨/૨૦૨૧ની જોગવાઈઓ તેમજ મિનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, અને ધી સીક્યુરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના અન્ય તમામ લાગુ પડતા કાયદાઓ અને જોગવાઈઓને અનુસરીને વિડિયો કોન્ફરન્સીંગ (વીસી)/અન્ય ઓડિયો વિડિયુઅલ મીડિયા (ઓએવીએમ)થી જોગવાઈમાં આવી છે, જેમાં ૬ઠ્ઠી સાધારણ સભા જોગવાઈ સૂચનામાં જણાવેલા સાધારણ અને વિશેષ વ્યવહારો હાથ ધરવામાં આવશે. કંપની એક્ટ, ૨૦૧૩ની કલમ ૧૦૩ હેઠળ વીસી/ઓએવીએમના માધ્યમથી વાર્ષિક સાધારણ સભામાં ભાગ લઈ રહેલા સદસ્યોની હાજરી કવોરમ માટે માન્ય ગણાશે.
  - ઉપરોક્ત પરિપત્રોની સૂચનાઓ અનુસરીને, વાર્ષિક સાધારણ સભા જોગવાઈ સૂચના અને ૨૦૨૦-૨૧નો વાર્ષિક અહેવાલ એવા સદસ્યો જેમના ઇમેઇલ સરનામાની કંપનીઝ/ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ(સ) પાસે નોંધાયેલા છે, તે તમામ સદસ્યોને ઇલેક્ટ્રોનિક કોપીઝના રૂપમાં મોકલી આપવામાં આવ્યા છે. વાર્ષિક સાધારણ સભાની સૂચના અને ૨૦૨૦-૨૧નો કંપનીનો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ [www.maximusinternational.in](http://www.maximusinternational.in) સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ એટલે કે બીએસઈ લિમિટેડની વેબસાઇટ [www.bseindia.com](http://www.bseindia.com) અને સીડીએસએલની વેબસાઇટ [www.evotingindia.com](http://www.evotingindia.com) પર ઉપલબ્ધ છે. શુક્રવાર, તા.૨૫મી જુન, ૨૦૨૧ના રોજ ઇમેઇલથી એજીએમની સૂચના મોકલવાની કામગીરી પૂરી કરવામાં આવી છે.
  - કંપનીના સદસ્યો, જેઓ કટ ઓફ ડેટ એટલે કે તા.૧૩મી જુલાઈ, ૨૦૨૧ના રોજ શેરો ધરાવે છે, તેઓ એજીએમની સૂચનામાં જણાવેલા હાથ ધરવાના વ્યવહારો અંગે મત, સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ) (સીડીએસએલ જે કંપની દ્વારા એજીએમ ઇ-વોટીંગની સુવિધા / રીમોટ ઇ-વોટીંગની સુવિધા અને વીસીથી એજીએમ જોગવાઈ માટે નિયુક્ત કરવામાં આવેલી એજન્સી છે) તેણી ઇલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમથી આપી શકશે. આથી તમામ સદસ્યોને જણાવવામાં આવે છે કે :
    - એજીએમમાં રીમોટ ઇ-વોટીંગ અથવા ઇ-વોટીંગ થી એજીએમની સૂચનામાં જણાવેલા હાથ ધરવા માટેના વ્યવહારોને લગતી કામગીરી થશે.
    - એજીએમમાં રીમોટ ઇ-વોટીંગ અથવા ઇ-વોટીંગ સિસ્ટમથી મતદાન કરવા માટેની પાત્રતા નક્કી કરવા માટેની કટ ઓફ ડેટ મંગળવાર, તા.૧૩મી જુલાઈ, ૨૦૨૧ નક્કી કરવામાં આવી છે.
    - રીમોટ ઇ-વોટીંગનો પ્રારંભ શનિવાર, તા.૧૭મી જુલાઈ, ૨૦૨૧ના રોજ સવારના ૯.૦૦ વાગે (આઈએસટી) થશે.
    - રીમોટ ઇ-વોટીંગ સોમવાર તા.૧૯મી જુલાઈ, ૨૦૨૧ના રોજ સાંજના ૫.૦૦ વાગે (આઈએસટી) પૂરું થશે.
    - રીમોટ ઇ-વોટીંગ મોડ્યુલ સોમવાર, તા.૧૯મી જુલાઈ, ૨૦૨૧ના રોજ સાંજના ૫.૦૦ વાગ્યા પછી બંધ કરવામાં આવશે.
    - વ્યક્તિગત શેરહોલ્ડર ના હોય એવા શેરધારકો જેઓ સૂચના જારી કર્યા પછી કંપનીના શેર મેળવે છે અને કંપનીના સદસ્ય બને છે તેવા કટ ઓફ ડેટ એટલે કે તા.૧૩મી જુલાઈ, ૨૦૨૧ના રોજ કંપનીના શેર ધરાવે છે, તેઓ મતદાન કરવા માટે, [helpdesk.evoting@cdslindia.com](http://helpdesk.evoting@cdslindia.com) ને વિનંતી મોકલીને લોગીન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. પરંતુ જો કે તે કે તેણીની રીમોટ ઇવોટીંગ/ઇ-વોટીંગ માટે સીડીએસએલ સાથે નોંધણી ધરાવતા હોય તો મત આપવા માટે તે પ્રવર્તમાન યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકશે. વ્યક્તિગત શેરધારકો જેઓ કિમટે સ્વરૂપમાં સિક્યુરીટીઝ ધરાવે છે અને નોટીસ મોકલ્યા પછી કંપનીના શેર મેળવે છે અને કટ ઓફ ડેટ તા.૧૩મી જુલાઈ, ૨૦૨૧ના રોજ કંપનીના શેર ધરાવે છે, તે એજીએમની નોટીસના મુદા નં. ૧૦ને અનુસરીને જરૂરી કાર્યવાહી કરી શકે છે.
    - સદસ્યો નોંધ લે કે :
      - સદસ્ય એક વાર ઠરાવ ઉપર મત આપીને પછી એ સદસ્યને મત બદલવાનો અધિકાર નથી.
      - એજીએમમાં પણ મત આપવાની વ્યવસ્થા રાખવામાં આવશે અને વીસીના માધ્યમથી જેઓ એજીએમમાં હાજરી આપી રહ્યાં છે તેવા સદસ્યો, કે જેમણે ઠરાવો પર રીમોટ ઇ-વોટીંગથી મત આપ્યો નથી, તેઓ એજીએમમાં ઇ-વોટીંગ સિસ્ટમથી મત આપી શકશે.
      - એવા સદસ્યો જેમણે એજીએમ પહેલા રીમોટ ઇ-વોટીંગથી મત આપ્યો છે તેઓ એજીએમમાં ભાગ લઈ શકશે પરંતુ ફરીથી મતદાન નહીં કરી શકે અને
      - કટ ઓફ ડેટના રોજ જેમનું નામ ડિપોઝીટરી દ્વારા જાળવવામાં આવતાં મેમ્બર્સના રજીસ્ટર અથવા બેનીફિશ્યલ ઓનર્સના રજીસ્ટરમાં નોંધાયેલું છે, માત્ર એવા સદસ્યો જ એજીએમમાં રીમોટ ઇ-વોટીંગ અથવા ઇ-વોટીંગની સુવિધા મેળવવા પાત્ર ગણાશે.
    - એજીએમની નોટીસમાં ડિમીટીરિયલાઈઝ્ડ સ્વરૂપમાં શેર ધરાવતા અને એવા સદસ્યો જેમણે પોતાના ઇમેઇલ સરનામાની નોંધ કરાવી નથી તેઓ કેવી રીતે રીમોટ ઇ-વોટીંગ કરી શકે તે દર્શાવવામાં આવ્યું છે.
    - જે સદસ્યોએ તેમના ઇ-મેઇલ સરનામાની નોંધ કરાવી નથી તેમને સંબંધિત ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ પાસે પોતાના ઇમેઇલ સરનામા અને મોબાઇલ નંબરની નોંધ કરાવી લેવા વિનંતી છે.
    - જે સદસ્યોને એજીએમ તેમજ સીડીએસએલની ઇ-વોટીંગ સિસ્ટમ અંગે કોઈ મુંઝવણ કે મુશ્કેલી હોય, તેઓ [helpdesk.evoting@cdslindia.com](http://helpdesk.evoting@cdslindia.com) ને ઇમેઇલ પાઠવીને અથવા ફોન નં. ૦૨૨-૨૩૦૫૮૭૩૮/૦૨૨-૩૩૦૫૮૫૪૨/૪૩ પર સંપર્ક કરીને સમાધાન મેળવી શકે છે.
    - ભુક કલોઝર :  
 કંપનીના રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક્સ બુધવાર, તા.૧૪મી જુલાઈ, ૨૦૨૧થી મંગળવાર તા. ૨૦મી જુલાઈ, ૨૦૨૧ (બંને દિવસો સહિત) સુધી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ની વાર્ષિક સાધારણ સભાને અનુલક્ષીને બંધ રાખવામાં આવશે.

*Vadodara Samachar 26/06/2021*  
 બોર્ડની સૂચનાથી,  
 મેક્સીમસ ઇન્ટરનેશનલ લિમિટેડ વતી